



Continuous Issue-27 | June - July 2017

## સ્થીઓની સલામતીના સંદર્ભે માનવ અધિકારોનું વૈશ્વિક ધોષણાપત્ર

સમસ્ત પૃથ્વી માટે આ યુગ જાગરણનો યુગ છે. તમામ રાષ્ટ્રોના સૌથી પાછળ રહી ગયેલા શોષિત, દલિત, પિડિત લોકોના જાગરણની આ શુભ ઘઢી છે. દેશદેશની નારી માત્ર આ છેવાડે ઉભેલા લોકોમાંની એક છે અને એ પણ જાગી રહી છે. જે જાગે છે તે જુએ છે કે આજે જે સમાજમાં આપણે જીવી રહ્યા છીએ, તે વર્તમાન સમાજના પ્રચ્યબિલ મૂલ્યો સમાજમાં સમાનતા, બંધુતા, ન્યાય સ્થાપી શકે નહીં. એટલે આ નવજગૃહ એકમોનો સહિત્યારો પોકાર ગગન ગજવે છે કે, આજના સમાજને બદલી નાંખો !

સમાજ-પરિવર્તન એ આજના યુગની માંગ છે. વિશ્વભરના નારી સમાજને આજનો આ લોહીની નદીઓ વહેવડાવનારો, યુદ્ધથી ખદબદતો, સત્તા અને સંપત્તિના કેન્દ્રીકરણ દ્વારા અન્યાય અને શોષણાની ઝડી વરસાવનારો સ્વર્ણમૂલક સમાજ પસંદ નથી. સ્ત્રી ઈંચ્છે છે શાંતિ, ન્યાય, સ્વતંત્ર્ય, સમાનતા અને સમાધાન ! પૂર્વે થઈ ગયેલા અનેક યુગપુરુષોના આર્થદર્શનમાંથી સ્ત્રીને સમજાઈ ગયું છે કે, એને માટે “અહિસક સમાજરચના” જ ન્યાયી અને પોષક રચના નિવડી શક્શે અને એટલે જ વિશ્વભરની જગૃત સ્ત્રી શક્તિનું મુખ્ય કામ છે, અહિસક સમાજનું નિર્માણ. આજના નિર્માણયુગમાં એકબાજુ માનવે અંતરિક્ષમાં પોતાની હરણફાળ ભરી, તો બીજી બાજુ ઘડીના છાટ્યા ભાગમાં પૃથ્વી આંબીને સમશાન બનાવી મૂકે તેવા ભયંકર શસ્ત્રાસ્ત્રો પણ બનાવ્યાં. એટલે આવા વિનાશક શસ્ત્રોનો વિરોધ કરવો જરૂરી થઈ પડ્યો. “યુદ્ધ વિરોધી સંસ્થાઓ દ્વારા આણું શસ્ત્રો સામે વિરોધ દાખવવા જે વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે, તેમાં ઈંલેન્ડમાં જિનહેન કોમન નામની સંસ્થા દ્વારા વિશ્વભરની બહેનો સત્યાગહ કરી રહી છે. કડકડતી હંડી હોય, આભેથી બરફ વરસતો હોય કે મૂશળખાર વરસાદ હોય, સ્ત્રીઓ મહિનાઓ ને મહિનાઓ સુધી તંબુઓમાં રહીને ટૂકડીવાર આણુશરત્રાના વિરોધમાં પ્રદર્શન યોજતી રહે છે.

અમેરિકા આજે નિઃશસ્ત્રીકરણની વાતો કરી રહ્યું છે, પરંતુ હજુ આજે પણ વોશિંગટન અને ન્યૂયોર્કમાં શસ્ત્રોનો ઉદ્યોગ ધમાકેદાર ચાલી રહ્યો છે. માનવસંખારક આ બોખોને લઈ જતી ગાડી સંકેત હોય છે. ટેકસાસ રાજ્યથી બે હજાર માઈલ દૂર એવા એક સિમાંત રથણે આ ગાડી મહાસાગરની પાનડૂબીઓ સાથે જોડી દેવામાં આવે છે. જે સાત સાગરોમાં ગમે ત્યાં જઈ શકે અને પાંચસો નગરોને એકી સાથે રાખમાં પલટાવી શકે.

વાસ્તવમાં સ્વસ્થ સ્ત્રી-પુરુષ-સંબંધ એ જ આંતરરાષ્ટ્રીય સ્તરે સમાનતાને સાર્થક કરવાનો ઉપાય છે અને ઘણા દેશોમાં જગૃત સ્ત્રી-પુરુષ આ દીશમાં સક્ષિય બનેલા છે. સ્ત્રીઓ પર થતા અત્યારાચો સામે સર્વત્ર સ્ત્રી હવે સંગઠિત થઈ રહી છે અને કેટલાક જુલ્લોના ખાત્મા માટે તો કાયદા બનાવવા માટે પણ માંગણી કરી રહી છે. સ્ત્રીઓના ગૃહકાર્યનું આર્થિક વળતર મળે તે માટે પણ પ્રયત્નો થઈ રહ્યા છે.

સ્ત્રીઓ પર થતાં અન્યાયો સામે માણું ઊંચકાય એ જરૂરી જ છે, પરંતુ વિદેશોમાં સ્ત્રીમુક્તિ આંદોલનોમાં પુરુષ વિરોધી વલણ વિકસાવતું હોય તેવું દેખાય છે. રાવો અભિગમ સ્વસ્થ નથી લાગતો. સ્ત્રીઓના પ્રશ્નો એ કેવળ સ્ત્રી જાતિના નથી, એ સમસ્ત સમાજના પ્રશ્નો છે. એમને ઉકેલવા સ્ત્રી-પુરુષ સમસ્ત સમાજની શક્તિ લાગવી જોઈએ.

ભારતના નારી-મુક્તિ આંદોલનોમાં પણ કયારેય આવું વિરોધી વલણ હોય તેવો ભાસ થાય છે, પરંતુ પુરુષ પ્રધાન સમાજ રચનામાં ઉછરેલા પુરુષો દ્વારા થતા સહજ વર્તનમાં પણ સ્ત્રીને આપખુદીપણું અને અવહેલના સતત અનુભવવી પડે છે કે, માનસમાં એક વિરોધી ભાવ દાખલ થઈ જાય છે. યુગ યુગાંતરથી સતત જે સંસ્કારો માનવચિત પર પડતા રહે, તે ધીરે ધીરે લોહીમાં આવી જાય છે. શું કુટુંબમાં કે શું સમાજમાં સર્વત્ર પુરુષનું અહું સતત પોષાતું આવું છે. એટલે સ્ત્રી-પુરુષ પરત્વે પુરુષમાં ગુરુતાશ્રીં બંધાઈ ગઈ છે. પરંતુ આ વચ્ચાગાળાની પ્રક્રિયા છે. અંતે તો સ્ત્રી-પુરુષો સાથે મળીને જ એકમેકની મુક્તિના દ્વાર ખોલી શક્શે. સ્ત્રી-પુરુષ સમાનતા સમજાતીને આધારે ઉભી થાય એ અહિસક સમાજ રચનાનો એક મહત્વનો આધારસત્તંભ છે.

છેલ્લા વીસ-નીસ વર્ષોમાં પણ દેશમાં કોઈ રાષ્ટ્ર્યાપી આંદોલન ન હોવા છાત્રાનું રાષ્ટ્રનિર્માણના કાર્યમાં નવયુવતીઓ પણ જોડાયેલી છે, તે અત્યંત આનંદ અને સંતોષની વાત છે. ભારત ભરમાં ટેરટેર ગ્રામવિકાસના જે સધનક્ષેત્રો ઉભા થયા છે, તેમાં ક્યાંક દંપત્તિરૂપે તો ક્યાંક સ્વતંત્ર વ્યક્તિરૂપે સ્ત્રીશક્તિ લાગેલી છે. નવા યુગના નવા માણસનું નવસર્જન અને પોતાની જીંદગીનો અત્યંત સોનેરી એવો યુવકાળ સંધર્ષ અને એવા કાર્યમાં લગાડી રહી છે. આજે દેશમાં બિલંગીન ટોપની જેમ ટેરટેર સ્વેચ્છિક સંસ્થાઓ કામ કરતી થઈ ગઈ છે, તેમાં કેટલાક કર્મશીલોનું કામ સાચે જ દ્રાષ્ટિપૂર્વક લગન સાથે થઈ રહેલું જણાય છે. ગ્રામીણ બહેનોમાં આ કાર્યશીલોના પ્રવેશ સાથે એક નવી ચેતના જગી હોય તેના દર્શન ટેરટેર થાય છે. આ વાત એ બાબતની પૃષ્ઠિ કરે છે કે આવનારો યુગ મહિલાઓનો યુગ છે.

1945 માં યુનાઇટેડ નેશન્સ ઓર્ગનાઇઝેશનના ચાર્ટરે શરૂઆત કરી અને સૈંપ્રથમાં પુરુષ સમાજ અધિકારો હોવા જોઈએ એમ નોંધણી થઈ યુનો (U.N.O) ના ઉપકરે 1946 માં દુનિયાના દેશોમાં “સ્ત્રીઓના દરજા” (Status of Women) ની તપાસ કરવા એક કંગ્રેસનિ નિમવનિના આવ્યું, તેથી આગળ વધી 1949 માં યુનોની જનરલ એસેમ્બલી દ્વારા કુમળી બાળાઓના આંતરરાષ્ટ્રીય લોહીના વેપાર ઉપર પ્રતિબંધ મુકાયો.

આમ એક યા બીજા કારણોસર “સ્ત્રી” અંગેની બાબતો આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચા રહી. 1970 માં તો એકે એક દેશમાં “સ્ત્રીઓના દરજા” અંગેની વિગતો ચોકાવનારી પુરવાર થઈ. દર વર્ષે માનવ વિકાસ અંગેના અહેવાલો યુનોના ઉપકરે બહાર પડવા લાગ્યા. આ અહેવાલો એ જહેમતપૂર્વક સમીક્ષા કરી કે, “જગતનો એકપણ દેશ એવો નથી કે જ્યાં લીધીઓનો સમાન દરજા હોય”. યુનોનો અહેવાલ કરે છે કે જગતની અડ્ધોઅડ્ધ વસ્તી સ્ત્રી-વર્ગની છે, તેના જીવનનો 2/3 સમય દેશ, સમાજ, કુટુંબની ઉત્ત્રતિમાં ગાળે, છતાં પણ જગતની 1/10 આવકની જ તે ભાગીદાર છે અને 1/100 ભાગ જેટલી જ મિલકત ધરાવે છે. (United Nations Development Report (UNDP -1995, 1996, 1997, 2000, 2003, 2004) ઉપરાંત પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓનું જીવન ધોરણ ઘણું નીચું છે. મહિલાઓમાં સૌથી વિશેષ ગરીબાઈનું પ્રમાણ છે. આમ દરેક દેશમાં

સ્ત્રીઓના પ્રશ્નો ઉપર ધ્યાન જવા લાગ્યું. આ અહેવાલો પહેલાં યુનોએ 1975 નું વર્ષ “મહિલા આંતરરાષ્ટ્રીય વર્ષ” જાહેર કર્યું હતું. યુનોમાં સ્ત્રીઓની સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરવા આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ. બધીજ સ્ત્રીઓની સામાન્ય સમસ્યાઓને તેમજ પ્રત્યેક દેશ, સમાજ, સંસ્કૃતિ, પ્રણાલિકાઓ અનુસાર પ્રશ્નો ચર્ચાય.

1980 માં ડેન્માર્કના કોપનહેગન શહેરમાં એક પરિષદનું આયોજન થયું. રાષ્ટ્રના ઘડતરમાં સ્ત્રીઓની શક્તિના, સ્વનિષ્ઠાના નૈરોભી નગરમાં સને 1995 માં ચીનના પાટનગર બૈંળગમાં આવી આંતરરાષ્ટ્રીય પરિષદો ભરાઈ. મહિલાઓની આયોજન તેમજ રાજકીય સરે પાર્લિમેન્ટમાં નિર્ણાયક ભાગીદારી હોવી જોઈએ. સત્તાના કેન્દ્રોમાં સ્ત્રીઓની નિશ્ચિત બેઠકોની માંગ ઉભી થઈ. આમ, આંતરરાષ્ટ્રીય સરે સ્ત્રીઓની સમસ્યાઓને સપાટી ઉપર આવવાથી તેના પડધા ભારતમાં પણ પડયા. સમાજમાં અડધો અડધ વસ્તી સ્ત્રીઓની છે. છતાં ઇતિહાસનાં પાંનાઓ પર તે એક અજાણ્યું પાત્ર રહી છે. દેશની ઉત્ત્રતિ, આર્થિક વિકાસમાં સુસંસ્કૃત સમાજને ટકાવવા બહેનોનો ફાળો અમૂલ્ય છે. પણ તેની નોંધ લેવાઈ નથી. સ્ત્રીએ સમજનું અવિભાજ્ય અંગ છે નિર્ણાયક ઘટક છે પણ તે દેશકાળની નોંધો, દસ્તાવેજોમાંથી અદ્દશ્ય રહી છે. સ્ત્રીઓના કાર્યોને, પ્રવૃત્તિઓને, તેના મંત્રવ્યો, અભિપ્રાયો, લખાણો ઉપર પ્રકાશ પડયો નથી. તે By-Pass થતી આવી છે. તેનો નજર અંદાજ થયો છે. છતાં આંતરરાષ્ટ્રીય સરે અને રાષ્ટ્રીય સરે મહિલા વિકાસ માટે તથા બંધારણાના આર્દ્ધશોને પૂર્ણ કરવા માટે જે કરારપત્રો, પરિષદો થયેલ છે તેની વિસ્તૃત છણાવટ કરવી યોગ્ય રહેશે.

સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓ પ્રત્યે આચરાતી હિંસા માનવઅધિકારો અને સ્વાસ્થ્યનો મુદ્દો બની ગયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (WHO) ની માહિતી પ્રમાણે વિશ્વમાં દરેક પાંચ માંથી ઓછામાં ઓછી એક સ્ત્રી પર પુરુષ કે પુરુષો દ્વારા શારીરિક કે જાતીય અત્યારાચ આચરાયો છે. એક અંદાજ એવો પણ છે કે સ્ત્રી પ્રત્યે આચરાતી હિંસા તે સ્ત્રીના મૃત્યુનું કે પ્રજનનક્ષમ સ્ત્રીઓને પાંગળી કરી મુક્તી અશક્તિનું કેન્સર જેવું કારણ બની રહ્યું છે. તેમજ ટ્રાફીક અક્રમાતો અને મેલેરિયા બંને મળીને આરોગ્યને હાનિ પહોંચાડે તે કરતા વધુ હાનિકારક બની ગયું છે.

સ્ત્રીઓ પ્રત્યે આચરાતી હિંસાને માનવઅધિકારના મુદ્દા નરીકે જઈએ તો સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન) દ્વારા જાહેર કરાયેલા 1948 ના ઘોષણાપત્ર પર નજર કરવી પડે. જી ઘોષણાપત્રની પૂર્વ તૈયારીમાં ભારતીય અધિકારીઓનું એક જીથી સામેલ થયું હતું. તેના અધ્યક્ષ ગુજરાતના વિદ્યુથી સત્તારી શ્રીમતી હંસાબહેન મહેતા હતા. ઘોષણાપત્રના ભરડાની ચર્ચા ખુલ્લી મુકાઈ, ત્યારે તરત જ પહેલા અનુયછેદ વિશે શ્રી હંસાબહેને પોતાનો વિરોધ પ્રદર્શિત કરતા માંગણી કરી હતી કે, પ્રથમ અનુયછેદમાંના શબ્દો સર્વ પુરુષો જન્મજાત સ્વતંત્ર છે અને ગૌરવ તેમજ અધિકારોમાં સમાન છે. (All men are born free equal in dignity and rights) તેમાં સુધારો કરીને સર્વ માનવીઓ જન્મજાત સમાન (All human beings are born equal) તેમ વાક્યરચના કરવી. “પુરુષો” શબ્દમાં સ્ત્રીઓ સમાય નહી માનવીઓમાં સ્ત્રીઓનો ઉલ્લેખ સમાઈ જાય તેથી તેમણે આવી માંગણી મૂકી હતી. ઘણી વિસ્તૃત ચચને અંતે તેમનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો હતો. માનવઅધિકાર ઘોષણાપત્રમાં અન્ય અનુયછેદ પણ સ્ત્રી તરફે છે. તેવું કેટલાક જુન્નું માનવું છે. અનુયછેદ 3 માં જ્ઞાનાવાયું છે દરેકને જીવવાનો, સ્વતંત્રતાનો અને પોતાની જાતની સલામતીનો અધિકાર છે. અનુયછેદ 4 માં સૂચયાયેલો અધિકાર છે, કોઈને પણ ગુલામી કે દાસતામાં રખાશે નહી. ગુલામી અને ગુલામોના વેપારનો એના તમામ સ્વરૂપોમાં નિષેધ કરવામાં આવશે. અનુયછેદ 5 માં કેઢેવાયું છે કોઈને પણ યાતનાપુર્ણ કે કુર અમાનવીય અથવા અપમાનકારક વ્યવહાર કે શિક્ષા કરાશે નહી.

માનવઅધિકાર ઘોષણાપત્રમાં નિર્દેશાયેલા આ અને આવા અન્ય અધિકારોપુરુષોની નાગરિક સ્વતંત્રતાને લક્ષ્યમાં રાખીને ઘડાયેલા હોય તેવું કેટલાક અભ્યાસીઓ માને છે. સ્ત્રીઓ અને પુરુષો સમાન કક્ષામાં માનવીઓ છે, તેવી પૂર્વધારણા સહિત વિચારીએ તો આ સર્વ અધિકારો સ્ત્રીના છે જી, પરંતુ વાસ્તવિકપણે જીવતી જીંદગીમાં સ્ત્રીઓ આવા અધિકાર મેળવે જ છે તેવું કહી શકાય નહીં. વધુમાં સ્ત્રીના માનવઅધિકાર સ્ત્રીના સ્ત્રીતને અનુલક્ષીને પણ હોવા જોઈએ તેવો આચાર હોઈ શકે. 1975 માં જ્યારે આંતરરાષ્ટ્રીય નારી વર્ષ ઉજવવાની ઘોષણા સંયુક્ત રાષ્ટ્રોએ કરી ત્યારે આવા આચાર વધુ બુલંડ બન્યા. 1976 માં એક વિશેષ સમિતિનું ગઠન “સંયુક્ત રાષ્ટ્રો” દ્વારા કરવામાં આવ્યું હતું. તે સમિતિને સ્ત્રી વિરુદ્ધ આચરાતા સર્વ પ્રકારના ભેદભાવ નિર્મિત કરવાની વિચારણા કરવાની કામગીરી સોંપાઈ હતી. 1979 માં તે સમિતિએ સ્ત્રી વિરુદ્ધ આચરાતા સર્વ પ્રકારના નિર્મૂલન સમજૂતિ (જેને ટૂંકમાં અંગેજ નામ Convention on the Elimination of all forms of Discrimination against Women ના આધારે CEDAW પરથી “સીડો ના” નામે ઓળખવામાં આવે છે.) “સીડો” “સંયુક્ત રાષ્ટ્રો” માં રજૂ કરી. 1981 માં તેને જરૂરી ટેકો મળતા આ સમજૂતી કાર્યાન્વિત બની. અત્યારે 165 સભ્ય રાષ્ટ્રોએ તે સમજૂતીને અનુમોદન આપ્યું છે. ભારતે 1993 માં અનુમોદન આપ્યું હતું.

યુનોએ ઘોષિતકરેલા સિધ્યાંત મુજબ બે પ્રકારના આંતરરાષ્ટ્રીય ખતપત્ર જાહેર કરવામાં આવેલ.

### (1) International Covenant on Economic, social and cultural rights, 1966 (આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો અંગેનું આંતરરાષ્ટ્રીય ખતપત્ર 1966)

આ માનવહક્કો માનવીની જન્મજાત ગરીમામાંથી ઉત્પત્ત થયેલા છે, તે બાબત માન્ય કરીને, માનવહક્કોના વિશ્વકક્ષાના જાહેરનામા અનુસાર, હંસલ કરી શકે માટે પ્રત્યેક વ્યક્તિ પોતાના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક હક્કો તથા દિવાની અને રાજકીય અધિકારો ભોગવી શકે તે માટે પરિસ્થિતિ સંપસ થાય તો જ માનવમાત્ર ભયમુક્ત તથા જરૂરિયાતો અંગેની નિશ્ચિતતા હંસલ કરી શકે. આ અર્થ વિશ્વના તમામ વ્યક્તિઓના આર્થિક, સામાજિક તથા સાંસ્કૃતિક અધિકારો ને રક્ષાવામાં આવેલ છે. તેના અમલીકરણ માટે વિવિધ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ, કન્વેન્શનો દ્વારા ચાલુ સભ્યએ કાયદાકીય પગલાં લેવા માટે દબાશ કરવામાં આવે છે. જેથી ઉદેશ ફળીમૂલ થઈ શકે.

### (2) International covenant on Civil & political right - 1966 દિવાની અને રાજનૈતિક અધિકારો અંગેનું આંતરરાષ્ટ્રીય ખતપત્ર, 1966

માનવહક્કોના વેચિક જાહેરનામાં ઘોષણા મુજબ સ્વતંત્ર માનવી સિવિલ અને રાજનૈતિક સ્વતંત્ર્ય તથા ભયમુક્ત અને માનવીની જરૂરીયાતો પ્રામ કરવા બાબતની નિશ્ચિતતા હંસલ કરે તે માટે ઓછી સ્થિતિ નિર્માણ કરવી આવશ્યક છે, જેમાં દરેક વ્યક્તિ તેના સિવિલ અને રાજનૈતિક અધિકારો તેમજ તેના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો ભોગવી શકે, તથા માનવ હક્કો તથા સ્વતંત્રતાઓ ના પાલન માટેનો સાર્વગિક સાદ ભબાવવા યુનોના ખતપત્ર હેઠળ તમામ રાષ્ટ્રો બંધાયેલા છે, તથા દરેક વ્યક્તિ પણ અન્ય લોકો તથા પોતાના સમાજ પ્રત્યેની ફરજના ભાગરૂપે તથા તેનું પાલન થાય તે માટે પ્રયાસો કરવાની ફરજ ધરાવે છે. યુનિવર્સલ ડેક્લેરશનમાં તેની યોગ્ય જોગવાઈ ન હોવાથી, આંતરરાષ્ટ્રીય કન્વેન્શનના સ્વરૂપમાં કોવેનાન્ટ્સ અને હુમન રાઇટ્સ-માનવ અધિકારો અંગેના કોવેનાન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા. આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોના કોવેનાન્ટ્સમાં કામ મેળવવાના અધિકાર, રોજગારીની ન્યાય શરતો કામદાર સંખ બનાવવાના, સામાજિક સુરક્ષાના, યોગ્ય જીવન ધોરણના આરોગ્ય તથા શિક્ષણના

અધિકારોનો સમાવેશ થાય છે. નાગરિક અને રાજકીય અધિકારો અંગેના ક્રોવેનન્ટસમાં જીવવાના અધિકારો તેમજ સલામતીના હરવા-ફરવાના, ધાર્મિક સ્વાતંચના તથા મેંડળ સ્થાપવાના અધિકારોનો સમાવેશ થાય છે તેમજ કોઈપણ પ્રકારના ભેદભાવ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જીતિય ભેદભાવની નાખૂંદી પણ માનવ અધિકારોના રક્ષણાનું એક પાસું છે માનવ અધિકારો અંગેના ક્રોવેનન્ટસ અમલમાં આવ્યા ન હતા, ત્યારે સને 1965 માં જનરલ કંબિટિઓ આંતરાષ્ટ્રીય કન્વેન્શન ઓન ઈલિમિનેશન ઓફ ઓલ ફોર્મ્સ ઓફ રસિયલ ડિસ્ક્રીમિનેશન એટલે કે જીતિય ભેદભાવની નાખૂંદી અંગેનું આંતરાષ્ટ્રીય કન્વેન્શન સર્વ સંમતિથી સ્વીકારી, રંગભેદની તથા જીતિય ભેદભાવની નીતિઓ પ્રત્યે સખ્ત નાપસંદગી વ્યક્ત કરી. આ કન્વેન્શનમાં જીતિય ભેદભાવની નાખૂંદી માટે તથા જીતિય જુથવાદ તથા રંગભેદના પ્રતિબંધ માટે વ્યવહારું પગલાં સૂચવવામાં આવ્યા.

રાષ્ટ્રસંઘ દ્વારા (ઇક્સિઝ આક્ઝિક્યાના ડરબન શહેરમાં) (World Conference Against Racial discrimination-WCAR) 28 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર- 2001 દરમ્યાન યોજાયેલ હતી જેમાં આપણા દેશ તથા અન્ય દેશમાંથી સરકારના પ્રતિનિધિઓ તથા સૈચિદ્ધ સંસ્થાના પ્રતિનિધિઓએ સંક્રિય રીતે ભાગ લીધેલ હતો.

આમ, માનવ અધિકારોના આ વૈશ્વિક ધોષણાપત્રનું યોગ્ય અમલીકરણ ભારતમાં થાય તે માટે ભારત સરકાર પ્રયત્નશીલ છે. જેમ કે, માનવ અધિકાર રક્ષણધારો, ૧૯૮૮નું, રાષ્ટ્રીય માનવ અધિકારપંચ તથા અન્ય કાયદાકીય જોગવાઈઓ અને ચુકાદાઓમાં સમાવી લેવામાં આવેલ છે. તે પુષ્ટિ આપે છે કે, આવનારા સમયમાં સંપૂર્ણપણે ધોષણાપત્રના તમામ અધિકારો દેશમાં અમલી બનશે. ફેંચ લેખિકા અને નારીવાદી વિચારક સિમોન હિ ભ્રૂવાનું આ જાણીતું વિધાન છે,

સ્ત્રીઓ પેઢા થતી નથી, અનેમની રચના કરવામાં આવે છે.

અર્થાત સ્ત્રી શું છે, કોણ છે. અને કેવી હોવી જોઈએ તે પિતૃસત્તાકના હિતમાં નક્કી કરાય છે. વર્તમાન ની આ ઘડીએ પણ સ્ત્રીઓ પરના જુલમો તો ચાલુજ છે. બલ્કે આ જુલમો હવે મુંગે મોઢે સાંખી લેવાતા નથી, અની સામે માથું ઉચ્ચકાઈ રહ્યું છે, અના પ્રત્યાધાત રૂપે સ્ત્રી સામેના અન્યાય આજે વધી રહ્યો છે. પરંતુ આનો એક જ ઉપાય છે જીગુતિ અને પોતાની ભીતર પડેલી શક્તિનું ભાન વિનોભાળાએ એક સુંદર સૂત્ર આપ્યું છે, જે પ્રત્યેક મુજિતપ્રેમી માટે પાથેયરૂપ છે.

"પોતાના પર ચલાવાતા કોઈપણ શાસન, સત્તા, નિયંત્રણ કે આપખુદીમાંથી મુક્ત થવું હોય તો એકમાત્ર ઈલાજ છે - આત્મશક્તિનું ભાન !"

વહું આત્મશક્તિની આ આત્મ ચેતના જોગ અને માનવ જીતિનું જીવન 'સત્યમ્ શિવમ્ સુંદરમ્' ના મંગળ દ્વાર ખોલે એ જ પ્રાર્થના. વર્તમાન સમયમાં મહિલાઓના મુખ્ય માનવ અધિકારો નીચે મુજબના ગણી શકાય.

(1) મહિલાઓની ગુમતા અંગેનો અધિકાર (Right to Privacy)

(2) આર્થિક સ્વાતંચનાનો અધિકાર

(Right to Economic Empowerment)

(3) રાજકીય સ્વાતંચનાનો અધિકાર

(Right to Political Empowerment)

(4) સ્ત્રી હોવાને નાતે ભેદભાવ અચરણ તે સામેનો અધિકાર

(Right against Gender Discrimination)

(5) ગર્ભપાત કરાવવાનો અધિકાર

(Right to Termination of Preganansy)

(6) જીતીય તંડુરસ્તીનો અધિકાર (Right to Sexualhealth)

(7) Right against stoking

(8) Right to Protection from Domestic Violence

(ધરેલુ હિંસાથી રક્ષણનો અધિકાર)

(9) Right to Marry (લગ્ન અંગેનો અધિકાર)

(10) Right to Social Security (સામાજિક સુરક્ષાનો અધિકાર)

આ ઉપરાંત પણ મહિલાઓના માનવ અધિકારો સંદર્ભમાં UNO એ વિવિધ બાબતો અંગે દરાવ પસાર કરાવી માનવ અધિકાર તરીકે મંજૂર કર્યા છે. જેમ કે...

➢ શિક્ષણ બાબતમાં ભેદભાવ સામે અધિકાર.

➢ સમાન વેતનનો અધિકાર

➢ ગુલામી પ્રથા સામે અધિકાર

➢ જબરજસ્તીથી વેશાવૃત્તિ સામે અધિકાર.

➢ સગભા મહિલાને દેહાંતદંડની સજા ન કરવી જોઈએ.

➢ જીતીય સત્તામણી વિરુદ્ધ અધિકાર

➢ સ્ત્રીઓનો આત્મસંમાનનો અધિકાર

➢ યુધ્ય પ્રદેશમાં મહિલાઓને રક્ષણનો અધિકાર.

➢ સલામતીનો અધિકાર

➢ ગૌરવ પૂર્વક જીવન જીવવાનો અધિકાર

➢ સ્વાતંચનો અધિકાર

➢ શોષણ વિરુદ્ધનો અધિકાર

મુનિસિપલ ક્રોપોરેશન ઓફ દિલ્હી વિ. સ્ટ્રી કામદારો આ કેસમાં સર્વોચ્ચ અધાલતે દરાવેલ કે આ સ્ટ્રી કામદારોને મેટરનીટી બેનિઝીટ એક્ટનો લાભ વધારે સરળતાથી આપવો જોઈએ. CEDAW ના આર્ટીકલ-11 ની જોગવાઈનો પણ ભારતમાં અમલી બનાવવામાં આવેલ. દરેક ક્ષેત્રમાં અને દરેક પ્રવૃત્તિમાં મહિલાઓ સાથે દર્શાવાતો ભેદભાવ, પછી તેનું સ્વરૂપ ગમે તે હોય, તો પણ તેને નાખૂદ કરવો જોઈએ.  
વ્યક્તિત્વમાત્રની આત્મ ચેતના જાગે અને માનવ જીતનું જીવન સત્યમું શિવશ્રુત સુંદરમું'ના મંગળ દ્વાર ખોલે એ જ પ્રાર્થના.

## References

- I. A. Surakumari (Ed.) : Women's Studies, An Emerging Academic Discipline (1993)
- II. A.N. Karia: Law, readatin welfare of A women & childern
- III. Ashokkumar & Harish : Women power, Status of women in India ( 1991)
- IV. Dr. Dimpal T Raval: International Convention & Women Empowerment(2016)
- V. A.N Karia & Dr. Dimpal T Raval: Women & Law (2009)

\*\*\*\*\*

**Dr. Dimpal T. Raval**  
 Assistant Professor & Head  
 Department of Law  
 Raksha Shakti University  
 Ahmedabad

Copyright © 2012 – 2017 KCG. All Rights Reserved. | Powered By: Knowledge Consortium of Gujarat